



The Gujarat State Co-op. Bank Ltd.

ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંક લિ.

(શિક્ષુલ્લ બેંક)




“સરદાર વલ્લભભાઈ પટેલ સહકાર ભવન”

પોસ્ટ બોક્સ નં.-૫, શાસ્ત્રીનગર બી.આર.ટી.એસ. બસ સ્ટેન્ડ પાસે, અંકુર રોડ, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩.

ફોન: ૦૭૯-૨૭૪૫૮૦૦૦-૦૧-૦૨-૦૩-૦૪ • ફેક્સ: ૦૭૯-૨૭૪૫૮૮૦૦

E-mail: loan@gsbank.coop • Website: www.gscbank.co.in

લોન અરજ ફોર્મ



અરજદારનું નામ _____

સેવિંગ્સ / કરંટ ખાતા નંબર

--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--

નોમીનલ સભાસદ નં. _____

સરનામું _____

મો. _____

જામીન નં.૧ નું નામ _____

સરનામું _____

મો. _____

જામીન નં.૨ નું નામ _____

સરનામું _____

મો. _____

બ્રાન્ચનું નામ _____

ટેલીફોન નં. _____

મેનેજરનો મોબાઈલ નં. _____

ધિરાણનો પ્રકાર _____

ઈનવર્ડ નં. _____ તારીખ : _____

નોંધ : અરજી સાથે જોડેલ તમામ દસ્તાવેજો નીચેની યાદીમાં અચૂક ટીક (✓) કરવા.

ચેકલીસ્ટ

(૧) અરજદારના આઈડી પ્રુફ (ગમે તે બે જરૂરી)	જામીનોના આઈડી પ્રુફ (ગમે તે બે જરૂરી)
☐ પાનકાર્ડ ☐ આધાર કાર્ડ ☐ ડ્રાઈવીંગ લાઇસન્સ ☐ ઇલેક્શન કાર્ડ (મતદાન ઓળખ પત્ર) ☐ પાસપોર્ટ	☐ પાન કાર્ડ ☐ આધાર કાર્ડ ☐ ડ્રાઈવીંગ લાઇસન્સ ☐ ઇલેક્શન કાર્ડ (મતદાન ઓળખ પત્ર) ☐ પાસપોર્ટ
(૨) અરજદારના રહેઠાણના પુરાવા (ગમે તે એક જરૂરી)	જામીનોના રહેઠાણના પુરાવા (ગમે તે એક જરૂરી)
☐ ઇલેક્ટ્રીક સીટી બીલ (છેલ્લા ૩ માસથી વધુ જુનું નહિ) ☐ ટેક્ષબીલ (લેટેસ્ટ) ☐ ટેલિફોન બીલ (છેલ્લા ૩ માસથી વધુ જુનું નહિ) ☐ ભાડાની પહોંચ/કરાર ☐ બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ (છેલ્લું બેલેન્સ દર્શાવતું) ☐ રેશન કાર્ડ	☐ ઇલેક્ટ્રીક સીટી બીલ (છેલ્લા ૩ માસથી વધુ જુનું નહિ) ☐ ટેક્ષબીલ (લેટેસ્ટ) ☐ ટેલિફોન બીલ (છેલ્લા ૩ માસથી વધુ જુનું નહિ) ☐ ભાડાની પહોંચ/કરાર ☐ બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ (છેલ્લું બેલેન્સ દર્શાવતું) ☐ રેશન કાર્ડ
(૩) અરજદારની આવકના પુરાવા	જામીનોની આવકના પુરાવા
☐ ઈન્કમેટેક્સ રીટર્ન તથા ફોર્મ-૧૬ / હિસાબો સહી-સિક્કા સાથે (પેઢી / કંપની / એલએલપીના કિસ્સામાં ઓડિટેડ) ☐ પગાર સ્લીપ (ફોર્મ નં. ૧૬/ સેલેરી સર્ટીફિકેટ) ☐ ખેતીના બીલો તથા તે અંગેનો ૭ x ૧૨ તથા ૮-અ નો જમીનનો દાખલો ☐ દૂધના દાખલામાં મંડળીના ખાતાનો ઉતારો તથા પ્રમાણપત્ર	☐ ઈન્કમેટેક્સ રીટર્ન તથા ફોર્મ-૧૬ / હિસાબો સહી-સિક્કા સાથે (પેઢી / કંપની / એલએલપીના કિસ્સામાં ઓડિટેડ) ☐ પગાર સ્લીપ (ફોર્મ નં. ૧૬/ સેલેરી સર્ટીફિકેટ) ☐ ખેતીના બીલો તથા તે અંગેનો ૭ x ૧૨ તથા ૮-અ નો જમીનનો દાખલો ☐ દૂધના દાખલામાં મંડળીના ખાતાનો ઉતારો તથા પ્રમાણપત્ર
(૪) અરજદારની મિલકતના પુરાવા	જામીનોની મિલકતના પુરાવા
☐ રજી. વેચાણ દસ્તાવેજ / વેચાણ ઈન્ડેક્સની નકલ ☐ ગુ.હા.બોર્ડ હોય તો કન્વેયન્સ ડીડ ☐ વેરો ભર્યાની પહોંચ તથા બીલ ☐ પ્રોપર્ટી કાર્ડ ☐ ૭/૧૨, ૮-અ તથા ૬/૨ અથવા આકારણી પત્રક (લેટેસ્ટ) ☐ શેર સર્ટીફિકેટ ☐ નાણાં ભર્યાની પહોંચો ☐ એલોટમેન્ટ તથા પ્લેશન લેટર ☐ રજી. સોસાયટી/એન.ટી.સી.નું નો ડ્યું સર્ટીફિકેટ / નો- ઓબજેક્શન સર્ટીફિકેટ ☐ એન.એ./એન.ઓ.સી. ☐ બાંધકામ / ડેવલોપમેન્ટનો કરાર તથા મંજૂરી ☐ મંજૂર પ્લાનની કોપી / બી.યુ. પરમીશન	☐ રજી. વેચાણ દસ્તાવેજ / વેચાણ ઈન્ડેક્સની નકલ ☐ ગુ.હા.બોર્ડ હોય તો કન્વેયન્સ ડીડ ☐ વેરો ભર્યાની પહોંચ તથા બીલ ☐ પ્રોપર્ટી કાર્ડ ☐ ૭/૧૨, ૮-અ તથા ૬/૨ અથવા આકારણી પત્રક (લેટેસ્ટ) ☐ શેર સર્ટીફિકેટ ☐ નાણાં ભર્યાની પહોંચો ☐ એલોટમેન્ટ તથા પ્લેશન લેટર ☐ રજી. સોસાયટી/એન.ટી.સી.નું નો ડ્યું સર્ટીફિકેટ / નો- ઓબજેક્શન સર્ટીફિકેટ ☐ એન.એ./એન.ઓ.સી. ☐ બાંધકામ / ડેવલોપમેન્ટનો કરાર તથા મંજૂરી ☐ મંજૂર પ્લાનની કોપી / બી.યુ. પરમીશન

- (પ) છેલ્લા ૬ માસનું બેંક સ્ટેટમેન્ટ/પાસબુક
- (૬) પાસપોર્ટ સાઈઝના ૨ લેટેસ્ટ ફોટોગ્રાફ
- (૭) અન્ય લોન હોય તેવા કિસ્સામાં લોન ખાતાનું સ્ટેટમેન્ટ (લોન ચાલુ થઈ ત્યારથી અત્યાર સુધીનું)
- (૮) મોર્ગેજમાં લેવાની મિલકતનું બેંક માન્ય વકીલશ્રીનો ટાઈટલ ક્લીયર રીપોર્ટ-સર્ટીફિકેટ
- (૯) મોર્ગેજમાં લેવાની મિલકતનું બેંક માન્ય વેલ્યુઅર દ્વારા કરવામાં આવેલ વેલ્યુએશનનો રીપોર્ટ
- (૧૦) ગૃહ વપરાશ/ખાનગી વાહન/ભાડના વાહન માટે જી.એસ.ટી. નંબર સાથેનું ક્વોટેશન. ભાડાના વાહન માટેની પરમીટ/ડ્રાઈવરનો બેજ/પ્રોજેક્ટ રીપોર્ટ
- (૧૧) અરજદારનું (ગ્રામ્ય અરજદારોના કિસ્સામાં) જામીનોનું (ગ્રામ્ય અરજદારોના કિસ્સામાં) સ્થાનિક સેવા સહકારી મંડળીનું નો-ડ્યું સર્ટીફિકેટ
- સ્થાનિક સેવા સહકારી મંડળીનું નો-ડ્યું સર્ટીફિકેટ
- (૧૨) મકાન બાંધકામ/એક્સટેન્શનના કિસ્સા માટે
- ☐ બાંધકામ કરવા માટે સક્ષમ ઓથોરીટીની પરવાનગી
- ☐ સક્ષમ ઓથોરીટી દ્વારા મંજૂર થયેલ પ્લાનની નકલ
- ☐ એન્જનીયરનું ખર્ચ અંગેનું એસ્ટીમેન્ટ
- ☐ કામ પૂર્ણ થયા અંગેનું એન્જનીયરનું પ્રમાણપત્ર
- ☐ બીલ/નાણાં ચુકવ્યાની રસીદ
- (૧૩) ઉચ્ચ શિક્ષણ લોનના કિસ્સામાં
- ☐ વિદ્યાર્થીનો પાસપોર્ટ/વીઝાની નકલ
- ☐ વિદ્યાર્થીનો એડમીશન મળ્યાનો પુરાવો તથા યુનિ. / કોલેજની ફી ની વિગત
- ☐ વિદ્યાર્થીના કોર્સના સમયગાળા દરમ્યાન કુલ અભ્યાસ ખર્ચની વિગતો
- ☐ વિદ્યાર્થીના શૈક્ષણિક પુરાવા, અભ્યાસક્રમની માહિતી, જન્મનું પ્રમાણપત્ર
- ☐ વિદ્યાર્થીના વાલીના આઈ.ડી., રહેઠાણ, આવક તથા મિલકતના પુરાવા.
- ☐ વાલીના સહ કરજદારના પુરાવા
- ☐ મિલકતનો બેંક માન્ય વેલ્યુએશન રિપોર્ટ
- ☐ મિલકતનો ટાઈટલ ક્લીયર રીપોર્ટ-સર્ટીફિકેટ
- ☐ બેંક લોન સિવાય વધારાના ખર્ચની કરેલ જોગવાઈની વિગતો
- (૧૪) હાઈપો.સી.સી. મંજૂર/રીન્યુના કિસ્સામાં
- ☐ છેલ્લા મહિનાનું સ્ટોક સ્ટેટમેન્ટ તથા દેવા-લેણાની યાદી (સી.એ. સર્ટીફાઈડ કોપી)
- (સ્ટોક ૬ મહિનાથી વધુ મુદત તથા ૬ મહિના સુધીની મુદત માટે અલગ બતાવવો)
- ☐ ૨ વર્ષના ઓડિટેડ નાણાંકીય પત્રકો તથા આઈ.ટી. રીટર્ન/એસેસમેન્ટ ઓર્ડર/જી.એસ.ટી. રીટર્ન
- ☐ વીમાની ઝેરોક્ષ નકલ (સ્ટોક તથા મિલકતની)
- ☐ સ્ટોક તથા મિલકતના બોજા નોંધની ઝેરોક્ષ નકલ
- ☐ ગીરો લેવાની મિલકતનું વેલ્યુએશન તથા ટાઈટલ ક્લીયર રીપોર્ટ-સર્ટીફિકેટ
- નોંધ સંયુક્ત મિલકતના કિસ્સામાં અન્ય માલિકોની નોટરાઈઝ સંમતિ લેવી જરૂરી છે, તથા તેઓને નોમીનલ સભ્ય બનાવી સહ કરજદાર/વધારાના જામીન તરીકે જોડવા.

ધી ગુજરાત સ્ટેટ કો-ઓપ. બેંક લિ.

(શિડ્યુલ્ડ એપેક્ષ બેંક)

“સરદાર વલ્લભભાઈ પટેલ સહકાર ભવન” શાસ્ત્રીનગર BRTS બસ સ્ટેન્ડ પાસે,
અંકુર રોડ, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩.

ફોન નં. ૦૭૯-૨૭૪૫૮૦૦૦-૦૧-૦૨, ફેક્સ નં. ૦૭૯-૨૭૪૫૮૮૦૦
E-mail : customercare@gscbank.coop • Website www. gscbank.co.in

કોમન લોન અરજી ફોર્મ
(નવી /રીન્યુ માંગણી)

પ્રતિ,
શ્રી જનરલ મેનેજર સાહેબ,
ધી ગુજરાત સ્ટેટ કો-ઓપ. બેંક લિ.
હેડ ઓફિસ, અમદાવાદ

બ્રાન્ચ : _____
બ્રાન્ચ કોડ નં. _____

વિષય : _____ લોનની માંગણી બાબત

લોનનો હેતુ : _____

સવિનય જણાવવાનું કે, હું / અમો નીચે સહી કરનાર અરજદાર (૧) શ્રી _____ આપની બેંકમાંથી
(૨) શ્રી _____ (અંકે રૂ. _____ પુરા) ની લોન/ઓવરડ્રાફ્ટ/સી.સી.
રૂ. _____ હપ્તા / _____ મુદત માટેની માંગણી મંજૂર/રીન્યુ કરવા વિનંતી કરું છું. / કરીએ છીએ.

લોન અરજદારની વિગત

વિગત	અરજદાર - ૧	અરજદાર - ૨
પુરુ નામ (અટક પહેલા લખવી)		
હાલના રહેઠાણનું સરનામું		
કાયમી સરનામું (જો ઉપરોક્ત કરતા જુદું હોય તો)		
શૈક્ષણિક લાયકાત		
ધંધાનો પ્રકાર અથવા નોકરી		
સંસ્થાનું નામ તથા સરનામું		
કુટુંબની કુલ આવક રૂ.		
કુટુંબની સભ્ય સંખ્યા		
કુલ માસિક ખર્ચ		
ખર્ચ કરતા આવકનો વધારો (રીપેઈંગ કેપેસિટી)		
આવક (માસિક - વાર્ષિક)		
ઉંમર-વર્ષ		
પાનકાર્ડ નંબર		
આધાર કાર્ડ નંબર		
ડ્રાઈવીંગ લાયસન્સ નંબર		
ઈલેકશન કાર્ડ નંબર		
પાસપોર્ટ નંબર		
રેશનકાર્ડ નંબર		
એસ.સી. /એસ.ટી./ઓ.બી.સી./જનરલ		
જાતિ (પુરુષ/સ્ત્રી)		
મોબાઈલ નંબર		
ઈ-મેઈલ		

વિગત	અરજદાર - ૩	અરજદાર - ૪
પુરુ નામ (અટક પહેલા લખવી)		
હાલના રહેઠાણનું સરનામું		
કાયમી સરનામું (જો ઉપરોક્ત કરતા જુદુ હોય તો)		
શૈક્ષણિક લાયકાત		
ધંધાનો પ્રકાર અથવા નોકરી		
સંસ્થાનું નામ તથા સરનામું		
કુટુંબની કુલ આવક રૂા.		
કુટુંબની સભ્ય સંખ્યા		
કુલ માસિક ખર્ચ		
ખર્ચ કરતા આવકનો વધારો (રીપેઈંગ કેપેસીટી)		
આવક (માસિક - વાર્ષિક)		
ઉંમર-વર્ષ		
પાનકાર્ડ નંબર		
આધાર કાર્ડ નંબર		
ડ્રાઈવીંગ લાયસન્સ નંબર		
ઈલેકશન કાર્ડ નંબર		
પાસપોર્ટ નંબર		
રેશનકાર્ડ નંબર		
એસ.સી. /એસ.ટી./ઓ.બી.સી./જનરલ		
જાતિ (પુરુષ/સ્ત્રી)		
મોબાઈલ નંબર		
ઈ-મેઈલ		

અરજદારોના બેંક ખાતાની માહિતી

વિગત	અરજદાર - ૧	અરજદાર - ૨
બેંકનું નામ		
શાખા		
બેંક ખાતાનો પ્રકાર		
IFS કોડ નં.		
ખાતેદારનું નામ		
ખાતા નંબર		
હાલમાં જે બેંક/નાણાંકીય સંસ્થાની લોન ચાલુ હોય તો તેની પુરી વિગતો જણાવવી.		

_____૧
અરજદારની સહી

_____૨
અરજદારની સહી

વિગત	અરજદાર - ૩	અરજદાર - ૪
બેંકનું નામ		
શાખા		
બેંક ખાતાનો પ્રકાર		
IFS કોડ નં.		
ખાતેદારનું નામ		
ખાતા નંબર		
હાલમાં જે બેંક/નાણાંકીય સંસ્થાની લોન ચાલુ હોય તો તેની પુરી વિગતો જણાવવી.		

_____૩
અરજદારની સહી

_____૪
અરજદારની સહી

જામીનોની વિગત

અમો નીચે સહી કરનાર જામીનો (૧) શ્રી _____
 અને (૨) શ્રી _____
 અરજદાર શ્રી _____ ની રા. _____
 (અંકે રા. _____ પુરા) ની ધી ગુજરાત સ્ટેટ કો-ઓપ. બેંક લિ.
 _____ બ્રાન્ચમાંથી ધિરાણ મેળવનારના જામીન થવા સંમતિ આપીએ છીએ. અમારી વિગતો નીચે મુજબ છે.

વિગત	જામીનદાર - ૧	જામીનદાર - ૨
પુરુ નામ (અટક પહેલા લખવી)		
હાલના રહેઠાણનું સરનામું		
કાયમી સરનામું (જો ઉપરોક્ત કરતા જુદું હોય તો)		
ધંધાનો પ્રકાર અથવા નોકરી		
સંસ્થાનું નામ તથા સરનામું		
આવક (માસિક-વાર્ષિક)		
ઉંમર - વર્ષ		
પાનકાર્ડ નંબર		
આધાર કાર્ડ નંબર		
ડ્રાઈવીંગ લાયસન્સ નંબર		
ઈલેક્શન કાર્ડ નંબર		
પાસપોર્ટ નંબર		
રેશન કાર્ડ નંબર		
એસ.સી./એસ.ટી/ઓ.બી.સી./જનરલ		
જાતિ (પુરુષ-સ્ત્રી)		
મોબાઈલ નંબર		
ઈ-મેઈલ		

જામીન - ૧ ની સહી _____ જામીન - ૨ ની સહી _____

તારીખ : _____ તારીખ : _____

મેં ઉપરોક્ત વિગતો ચકાસી છે જે સંપૂર્ણ સાચી છે.

બ્રાન્ચ મેનેજરની સહી તથા સિક્કો
 નામ _____
 ઈ.ડી.પી. નંબર _____
 બ્રાન્ચ _____

(૪)

અરજદારો

અ. નં.	અરજદાર/પ્રોપ્રાઈટર/ભાગીદાર/ ડિરેક્ટરોના નામ તથા ઉંમર	નોમીલ સભાસદ નંબર/તારીખ	લેટેસ્ટ ફોટોગ્રાફ	સહી
૧.	ઉંમર વર્ષ :			
૨.	ઉંમર વર્ષ :			
૩.	ઉંમર વર્ષ :			
૪.	ઉંમર વર્ષ :			

જામીનદારો

અ. નં.	જામીનદારોના નામ	નોમીલ સભાસદ નંબર/તારીખ	લેટેસ્ટ ફોટોગ્રાફ	સહી
૧.	ઉંમર વર્ષ :			
૨.	ઉંમર વર્ષ :			

અરજદારો

અ. નં.	અરજદાર/પ્રોપ્રાઈટર/ભાગીદાર/ ડિરેક્ટરોના નામ તથા ઉંમર	નોંધીલ સભાસદ નંબર/તારીખ	લેટેસ્ટ ફોટોગ્રાફ	સહી
૧.	ઉંમર વર્ષ :			
૨.	ઉંમર વર્ષ :			
૩.	ઉંમર વર્ષ :			
૪.	ઉંમર વર્ષ :			

જામીનદારો

અ. નં.	જામીનદારોના નામ	નોંધીલ સભાસદ નંબર/તારીખ	લેટેસ્ટ ફોટોગ્રાફ	સહી
૧.	ઉંમર વર્ષ :			
૨.	ઉંમર વર્ષ :			

DETAILS OF ASSETS AND LIABILITIES OF APPLICANT/CO-APPLICANT

1.	LIQUID ASSETS & INVESTMENTS PARTICULARS	AMOUNT (Rs.) ORIGINAL PRICE	HELD IN NAME OF (RELATION)
	A. N.S.C/K.V.P./I.V.P.		
	B. P.P.F.		
	C. L.I.C./ULIP (SURRENDER VALUE OR PAID TO DATE)		
	D. SHARES & DEBENTURES		
	E. BANK & OTHER DEPOSITS		
	F. OTHERS		
	I. INVESTMENT IN BUSINESS CONCERN(S)		
	II. P.F./CAPITAL		
2.	MOVABLE PROPERTIES		
	A. GOLD-SILVER & JEWELLERY		
	B. HOUSE-HOLD CONSUMER DURABLES		
	C. OTHERS-VEHICLES (SPECIFY MAKE/REG NO.)		
3.	IMMOVABLE PROPERTIES-HOUSE-LAND & BUILDINGS (GIVE FULL ADDRESS, AREA OF PLOT/HOUSE/ FLAT AND APPROXIMATE MARKET VALUE)(Rs.)		
	A. RESIDENTIAL PROPERTY LATEST TAX BILL/ SHARE CERTIFICATE (ZEROX ATTACHED) MARKET VALUE RS.		
	B. COMMERCIAL PROPERTY LATEST TAX BILL/ SHARE CERTIFICATE (ZEROX ATTACHED) MARKET VALUE RS.		
	C. AGRICULTURAL PROPERTY VILLAGE FORM NO.8/A OR 7/12 [Latest]		
4.	TOTAL WORTH		

પ્રોપરાયટર / માલિક / ભાગીદારો / ડીરેક્ટરો / સહકારી મંડળીના સભ્ય હોય તેની વિગતો

સમાંતર જામીનગીરીમાં આપેલ / આપવાની બોજામુક્ત ટાઈટલ કલીયરવાળી બીનખેતી વિષયક મિલકતની વિગત

અ.નં.	મિલકત / સિક્યોરીટી ધરાવનારનું નામ	સિક્યોરીટી અંગેનું સરનામું	કુલ ક્ષેત્રફળ	બોજો છે ?	કઈ સંસ્થાનો બોજો છે ?	મુળ કિંમત રૂ.	બજાર કિંમત રૂ.	એપ્રુવડ વેલ્યુએશન સર્ટી. મુજબ કિંમત રૂ.

વધારાની / ખુટતી જામીનગીરીમાં આપેલ / આપવાની જંગમ મિલકતની માહિતી
એન.એસ.સી. / કે.વી.પી./ બોન્ડ / લાઈફ પોલીસી / અન્ય

ખરીદનારનું નામ	ખરીદ તારીખ	સર્ટી નં.	મુળ રકમ રૂ.	પાકતી તારીખ

ધી ગુજરાત સ્ટેટ કો-ઓપ. બેંક લિ.

(શિડ્યુલ્ડ એપેક્ષ બેંક)

“સરદાર વલ્લભભાઈ પટેલ સહકાર ભવન” શાસ્ત્રીનગર BRTS બસ સ્ટેન્ડ પાસે,
અંકુર રોડ, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩.

ફોર્મ ડી-ડી

નિયમ ૨૪-એ પ્રમાણે

તારીખ / /

હું/અમો : _____

રહેવાસી : _____

તે નીચે જણાવેલ સહકારી બેંક અગર સહકારી શરાફી મંડળીનો સભ્ય છું/છીએ.

૧. _____

૨. _____

૩. _____

૪. _____

અમો ગુજરાત કો-ઓપ. સોસાયટીઝના નિયમ - ૨૪-એ પ્રમાણે એકરાર કરી જાહેર કરીએ છીએ કે :

અમો ફક્ત ધી ગુજરાત સ્ટેટ કો-ઓપ. બેંક લિ. માંથી કરજે નાણાં લઈશું અને ફક્ત ધી ગુજરાત સ્ટેટ કો-ઓપ. બેંક લિ. માં જ જામીન તરીકે અગર બીજી કોઈ કબુલાત આપીશું અગર જામીનગીરી સ્વીકારીશું. અમો વધુમાં વિશ્વાસ આપી જાહેર કરીએ છીએ કે ઉપરોક્ત બેંક સિવાય બીજી કોઈ સહકારી શરાફી મંડળી કે સહકારી બેંકમાંથી કરજે નાણાં લઈશું નહીં. અગર બીજી કોઈ જામીનગીરી કે જવાબદારી સ્વીકારીશું નહીં.

અમો વધુમાં જણાવીએ છીએ કે અમોએ આ અગાઉ આવો કોઈ એકરાર બીજી કોઈ સહકારી બેંક કે શરાફી મંડળીને કરી આપેલ નથી.

આ એકરારનો અમો ભંગ કરીએ તો બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ / એકઝી. કમીટી તથા બેંકના હોદ્દાઓ જરૂરી કાયદેસરના પગલાં લેવા હક્કદાર રહેશે.

સહી : _____

હું/અમો અરજદાર તથા જામીનો આથી જાહેર કરીએ છીએ કે આ અરજી પત્રકમાં લખેલ અને જાહેર કરેલ તમામ નિવેદનો, વિગતો સંપૂર્ણપણે સાચા છે અને બેંકના નિયમો, પેટાકાયદા અને તેમાં થનાર વખતો વખતનાં સુધારા વધારા અમોને કબુલ અને બંધનકર્તા છે.

અમો વધુમાં જણાવીએ છીએ કે બેંકનું ધિરાણ વ્યાજ અને અન્ય ખર્ચા સહિત પૂરેપૂરું અને બેંકને સંતોષ થાય તે રીતે ચુકતે ન થાય ત્યાં સુધી અરજદાર અને જામીનોની સંયુક્ત અને સમવ્યાપી જવાબદારીઓ ચાલુ રહેશે. અગાઉ આપેલ મિલકત તથા તે કરારો અને દસ્તાવેજો હું /અમો બેંકની તરફેણમાં ચાલુ રાખવા માગું છું / માંગીએ છીએ, તથા સદર ધિરાણ સામે બેંકની સીક્યુરીટી જળવાઈ રહે તે માટે કરી આપેલ રજીસ્ટર્ડ મોર્ગેજ/સાદા મોર્ગેજને આ સાથે એક્ષટેન્ડ કરી આપું છું/આપીએ છીએ.

વ્યાજનો દર વખતોવખત બેંક નક્કી કરે તે અથવા રીઝર્વ બેંકની / નાબાર્ડની સુચના પ્રમાણે જે નક્કી થાય તે અમોને મંજૂર / બંધનકર્તા રહેશે. અન્ય ચાર્જસ જેમ કે લીગલ ફી, પ્રોસેસીંગ ફી, સ્ટેશનરી ચાર્જસ, સ્થળ તપાસ કે ઈન્સ્પેક્શન ફી વિ. સમયે સમયે જે થાય અથવા ખાતામાં ઉધારાય તે ભરી આપવા અમો સંમત છીએ. તારણમાં રહેલ મિલકતનો વીમો બેંકની તરફેણમાં અમે રજુ કરીશું તથા નિયમિત રીન્યુ કરાવીશું તેમ થવામાં કસુર થયેથી બેંક અમારા વતી જરૂરી વીમો મેળવી લે તેમાં અમો સહમત છીએ ને તે અંગે જરૂરી રકમ અમે ભરવા બંધાયેલા છીએ. પરંતુ બેંકે વીમો રીન્યુ ન કરાવેલ હોય તો તેની જવાબદારી બેંકની નથી. પરંતુ અમારી જ છે અને અમારી જ રહેશે તે અમો સ્વીકારીએ છીએ.

સ્થાનિક સ્વરાજની સંસ્થા, સરકારી કે અર્ધસરકારી સંસ્થાના કોઈપણ કરવેરા કે લેણા ચુકવવાનાં બાકી નથી અને જો રહેશે તે અમો ચુકવી આપવા સંમત છીએ.

ધિરાણ મળ્યા બાદ અમારા હિસાબો/સ્ટેટમેન્ટમાં બેંકનું કરજ અને અન્ય કરજની પુરેપુરી વિગતો દર્શાવીશું. અન્ય તમામ બેંકના ખાતા/ધિરાણો બંધ કરી માત્ર આ જ બેંકમાં ખાતુ ચલાવીશું અને એવી જરૂર પડે આપની મંજૂરી પ્રથમ મેળવીશું.

જામીનદારોની સહી ૧. _____ અરજદારોની સહી ૧. _____
૨. _____ ૨. _____

શાખા મેનેજરની સહી તથા સિક્કો

નામ _____

ઈ.ડી.પી. નંબર _____

શાખા _____

ધંધાદારી માટે
લોન માંગણી કરનાર વ્યક્તિ / પેઢીના બંધારણની વિગત

૧. બંધારણ : વ્યક્તિગત / પ્રોપરાઈટર / ભાગીદારી પેઢી / કંપની / એલએલપી / લઘુ ઉદ્યોગ / મંડળી
૨. નોંધણી નં. : _____ તારીખ : _____
૩. પેઢીનો પાન નં. : _____ ૪. જી. એસ. ટી. નં. : _____
૫. લાયસન્સ નં. : _____ તારીખ : _____
૬. ધંધાનો પ્રકાર : _____ ધંધો શરૂ કર્યા તારીખ : _____

ધંધાના પ્રોપરાઈટર / ભાગીદારો / ડીરેક્ટરોની વિગત :

અ.નં.	નામ	ઉંમર	સરનામું	હોદ્દો

ધંધાના પ્રોપરાયટર / માલીક / ભાગીદારો / ડીરેક્ટરોની મિલકતની વિગત :

અ.નં.	નામ	મિલકતનું વર્ણન	અંદાજે કિંમત	બોજાની વિગત	મિલકતની કિંમત

અરજદાર / પેઢીની નાણાંકીય વિગત

અ.નં.	નાણાંકીય વર્ષ	ખરીદી	વેચાણ	નફો	મુડી	આખરસ્ટોક	ઉઘરાણી	વેપારી દેવું

માંગણી કરનાર પેઢી અગર ભાગીદારો / માલીક આ બેંક / અન્ય બેંક / સંસ્થામાંથી ધિરાણ લીધાની વિગત

ધિરાણ લેનાર	બેંકનું નામ	બ્રાન્ચ	ધિરાણનો પ્રકાર	ધિરાણની રકમ	હાલ ઉપાડ

તા. _____

અરજદારની સહી _____

ઉપરોક્ત વિગતો મેં ચકાસી છે જે સંપૂર્ણ સાચી છે.

બ્રાન્ચ મેનેજરની સહી તથા સિક્કો _____

ઈ.ડી.પી. નંબર _____

ધંધાકીય માહિતી

લોનનો પ્રકાર : વર્કિંગ કેપીટલ કેશ કેડિટ / ઓવરડ્રાફ્ટ / કોમર્શિયલ પ્રોપર્ટી લોન / ટર્મ લોન

વિગત	૩૧-૦૩	૦૧-૦૪ થી ૩૧-૦૩	૦૧-૦૪ થી અરજી કર્યા અગાઉના માસ સુધીના આંકડા
વેચાણ / ઉત્પાદન			
ખરીદી			
બંધ સ્ટોક સરવૈયા મુજબ (સીએ સર્ટિફિકેટ પત્રક સામેલ કરવું.)			
કાચો નફો			
ચોખ્ખો નફો			
માલિક / ભાગીદારોની મૂડી (મૂડી ખાતાના ઉતારા સામેલ કરવા)			
અન્ય બેંકોના કરજ (સરવૈયા મુજબ) (બેંક સ્ટેટમેન્ટ સામેલ કરવું)			
શરાફી દેવા			
શરાફી લેણાં			
વેપારી દેવા			
વેપારી લેણાં			

- નોંધ : (૧) દર વર્ષે ખાતેદાર પાસે શાખા મેનેજરશ્રીએ ઉપરોક્ત રિપોર્ટ ભરાવવાનો રહેશે.
(૨) પાકા સરવૈયા / નફા નુકશાન ખાતાના રીપોર્ટ સામેલ કરવાના રહેશે.

સહી તથા સિક્કો _____
બ્રાન્ચ મેનેજરનું નામ _____
ઈ.ડી.પી. નંબર _____

ધંધાકીય માહિતી

લોનનો પ્રકાર :- વર્કિંગ કેપીટલ કેશ કેડિટ / ઓવરડ્રાફ્ટ / કોમર્શિયલ પ્રોપર્ટી લોન / ટર્મલોન

માંગણી કરનાર એકમની માહિતી :

૧. રજુ કરેલ ક્વોટેશનની કિંમત _____ મશીનરીની કિંમત _____
 ૨. ઉધાર શાખ કેટલા દિવસ માટે _____ ૩. એવરેજ હાથ ઉપરનો સ્ટોક _____
 ૪. ખરીદ શાખ કેટલા દિવસ માટે _____ ૫. પ્રોજેક્ટ કોસ્ટ _____
 ૬. વિજળી કનેક્શન કોના નામે / કેટલા એચ. પી. નું છે. _____

સિક્યોરીટી :-

સ્થાવર મિલ્કતનું વિગતવાર વર્ણન

મિલ્કત ધારકનું નામ / સંબંધ			
મિલ્કતનું સ્થળ			
(ચાર દિશા) ઉતર	દક્ષિણ	પૂર્વ	પશ્ચિમ
મકાન નંબર		ગામ અથવા શહેર	
મિલ્કતનો સર્વે નંબર		તાલુકો / જિલ્લો	
મિલ્કતની ૭/૧૨, ૬ અને		મિલ્કતનું વેલ્યુએશન	રૂ.
૮-અ ની નકલ			તા.
સીટી સર્વેની નકલ		કાર્યકારી મૂડીની	રૂ.
		જરૂરીયાત	
આકારણી પત્રક			
છેલ્લી ટેક્ષ ભર્યાની પહોંચ			

રીમાર્ક્સ :

સ્થળ : _____

તારીખ : _____

અરજદારની સહી

(૧) _____

(૨) _____

(૩) _____

(૪) _____

ઉપરોક્ત વિગતો મે ચકાસેલ છે જે સંપૂર્ણ સાચી છે

બ્રાન્ચ મેનેજરની સહી તથા સિક્કો _____

ઈ.ડી.પી. નંબર : _____

વર્કિંગ કેપીટલ કેશ ક્રેડિટ / ઓવરડ્રાફ્ટ લિમિટની ગણતરી

(A) First method

1	Average Valid stock on hand (as on date)	
2	Add.(+) Book Debts/ Debtor Up to 90 Days	
3	Less (-) Creditors	
4	Total: (1+2-3)	
5	Less : 25% Margin	
6	Net Credit to be Sactioned (4-5)	

(B) Second Method

1	30% of Actual Sales / Turnover of Current year / Last year	
2	30% of 2 years of Average Projected Turnover	
	Which ever is applicable	

(C)

1	Which ever is higher of (A & B)	
---	---------------------------------	--

(D) Third method

1	60% of value of the property mortgaged (Market value approved by our Bank valuer)	
---	--	--

(E) Proposed Limit

	The amount of limit sanctioned will be lowest of C & D above	
--	--	--

રૂા. _____ ની વર્કિંગ કેપીટલ કેશ ક્રેડિટ/ ઓવરડ્રાફ્ટ સવલત (દર વર્ષે હેડ ઓફિસથી રિન્યુ કરાવવાની શરતે) મંજૂર કરવા ભલામણ.

બ્રાન્ચ મેનેજરની સહી તથા સિક્કો _____
 બ્રાન્ચ મેનેજરનું નામ _____
 ઈ.ડી.પી. નંબર : _____

ભાડના વાહનો માટેની પૂરક માહિતી

મોટર / ટ્રક / ઓટો રીક્ષા તથા અન્ય ભાડાની આવક આધારીત વાહનો માટેની પૂરક માહિતી

(A) વાહન પ્રતિમાસ _____ દિવસ કામ કરશે. દૈનિક _____ કિલોમીટર મુજબ માસિક કિલોમીટરના ભાડાના દર રૂા. _____ મુજબ રૂા. _____ માસિક આવક થશે. વર્ષ દરમ્યાન _____ માસ વાહન ચલાવતા કુલ વાર્ષિક આવક રૂા. _____ થશે.

(B) વાહનનો વાર્ષિક ખર્ચ નીચે મુજબ અંદાજેલ છે.

૧.	વાર્ષિક _____ લીટર બળતણનો (પેટ્રોલ/ડીઝલ/સી.એન.જી. / ઓઈલ ખર્ચ પ્રતિ લીટરના રૂા. _____ મુજબ)	રૂા. _____
૨.	વાર્ષિક ટેક્ષની રકમ	રૂા. _____
૩.	વાર્ષિક કુલ વીમા પ્રીમિયમ	રૂા. _____
૪.	કુલ કિંમતના ૧૦ % મુજબ ઘસારો	રૂા. _____
૫.	બેંક લોન રૂા. _____ નું _____ % મુજબ વ્યાજ	રૂા. _____
૬.	રોકાણના ૧૦ % મુજબ વાહન રીપેરીંગ ખર્ચ	રૂા. _____
૭.	વાહન ચાલકનો વાર્ષિક પગાર	રૂા. _____
૮.	વ્યવસ્થાપક સ્ટાફનો વાર્ષિક પગાર	રૂા. _____
૯.	પરચુરણ ખર્ચ	રૂા. _____
	(B) કુલ ખર્ચ (૧ થી ૯)	રૂા. _____
(C)	ગ્રોસ બચત (A-B)	રૂા. _____
(D)	આવકવેરો	રૂા. _____
(E)	ચોખ્ખી બચત (C-D)	રૂા. _____
(F)	ચોખ્ખી બચતમાં વાર્ષિક ઘસારો ઉમેરતા (B-૪+E) ચોખ્ખી માસીક બચત	રૂા. _____

_____ અરજદારની સહી
ઉપરોક્ત વિગતો મેં ચકાસેલ છે જે બરોબર છે.

_____ બ્રાન્ચ મેનેજરની સહી તથા સિક્કો

નામ : _____

ઈ.ડી.પી. નંબર : _____

શાખા : _____

ઉચ્ચ અભ્યાસ લોન માટે : (સ્વદેશ / પરદેશ) (લઘુત્તમ ધો. ૧૨ પાસ જરૂરી)

શૈક્ષણિક લાયકાત	બોર્ડ/યુનિવર્સિટી	પાસ કર્યાનું વર્ષ	પ્રયત્નોની સંખ્યા	મેળવેલ ટકા	મેળવેલ વર્ગ

- (એ) વિદ્યાર્થીના (સહ કરજદાર) વાલીનું નામ / સંબંધ / ઉંમર :- _____
- (બી) અભ્યાસ અર્થે જવા માટેની સંસ્થાનું નામ / સરનામું :- _____
(એડમીશન મળ્યાના પત્રની નકલ બીડવી) _____
- (સી) કોર્સની વિગત :- _____
- (ડી) કોર્સની મુદત :- _____
- (ઈ) કોર્સ અંગેના તમામ ખર્ચની માહિતી :- _____
(ફી / પુસ્તકો / હોસ્ટેલ / પ્રવાસ વગેરે) _____
- (એફ) અભ્યાસક્રમ પૂર્ણ થવાની તારીખ :- _____

નોંધ : પરદેશ માટેના કિસ્સામાં પાસપોર્ટના દરેક પાનાની, વીજાની તથા હોસ્ટેલમાં પ્રવેશ મળ્યાના દાખલાની ઝેરોક્ષ જોડવી.

અરજદારની સહી
ઉપરોક્ત વિગતો મેં ચકાસેલ છે જે બરોબર છે.

બ્રાન્ચ મેનેજરની સહી તથા સિક્કો

નામ : _____

ઈ.ડી.પી. નંબર : _____

શાખા : _____

ધી ગુજરાત સ્ટેટ કો-ઓપ. બેંક લિ.

સ્થળ ચકાસણી રીપોર્ટ

શાખા _____

કોડ નં. _____

તારીખ _____

પ્રતિ,

શ્રી જનરલ મેનેજર સાહેબ,

હેડ ઓફિસ, અમદાવાદ.

વિષય : અરજદાર શ્રી _____ ની _____

હેતુ માટેની લોન અરજી તથા અરજદારના રહેઠાણ તેમજ નોકરી/ધંધાના સ્થળ ચકાસણી બાબત.

સવિનય જણાવવાનું કે અમારી શાખામાં અરજદાર શ્રી _____ ની રૂા. _____ ની _____ હેતુ માટેની લોન માંગણીના કાગળો તારીખ _____ ના રોજ આવેલ છે. માંગણીના આવેલ કાગળોની મેં ચકાસણી કરેલ છે જે બેંકની આ અંગેની ધિરાણનીતિ તેમજ નીતિ-નિયમો / શરતો મુજબ બરોબર છે તેમજ સામેલ કરેલ સાધનીક પુરાવા સાચા છે. વધુમાં લોન અરજીમાં જણાવ્યા મુજબ અરજદારના રહેઠાણ તેમજ નોકરી/ધંધાના સ્થળની ચકાસણી કરેલ છે. અરજદારનો ધંધો / નોકરી _____ (જો નોકરી હોય તો તે સંસ્થાનું નામ-સરનામું) છે જે બરાબર અને સાચી હકીકત છે. અરજદારને તેમની માંગણી મુજબના હેતુ માટે લોન મંજૂર કરવામાં આવે તો લોન ભરપાઈ કરવાની પુરી ક્ષમતા ધરાવે છે.

ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં લેતા અરજદારની રૂા. _____ ની _____ હેતુ માટેની લોન મંજૂર કરવા અત્રેથી ભલામણ કરવામાં આવે છે તેમજ સામેલ ઝેરોક્ષ કોપીને મેં અસલ કોપી સાથે ચકાસણી કર્યા બદલની સહી કરેલ છે.

જે મિલકત માર્ગેજમાં આપવાની છે તેની વિગત	જામીનોની મિલકત ની વિગત :
માલિકનું નામ : _____	જામીન : (૧) _____
મિલકતનું સરનામું : _____	સરનામું : _____
_____	_____
_____	જામીન (૨) _____
આશરે કિંમત : _____	સરનામું : _____

નોંધ : જરૂર જણાય તો જુદા પેપર ઉપર

વિગતવાર રીપોર્ટ સામેલ કરવો.

બ્રાન્ચ મેનેજર / ઓફિસરની સહી તથા સિક્કો

નામ: _____

ઈ.ડી.પી. નંબર _____

ભલામણ રીપોર્ટ સાથે લોનના હેતુ મુજબ આપવાની માહિતી

(એ) મિલકત મોર્ગેજ લેવાતી લોનના કિસ્સામાં :

(૧) મિલકતની કિંમત : (બાનાખત / દસ્તાવેજ / વેલ્યુએશન / એસ્ટીમેન્ટ મુજબ)

રૂા. _____

(૨) મળવા પાત્ર ભલામણની રકમ :

રૂા. _____

(ક) મકાન / કોમર્શિયલ પ્રોપર્ટી લોન દસ્તાવેજ

_____ % રૂા. _____

(ખ) મકાન રીપેરીંગ / બાંધકામ એસ્ટીમેન્ટના

_____ % રૂા. _____

(ગ) સીક્યોરીટી મોર્ગેજ ઓ.ડી. /લોન વેલ્યુએશનના

_____ % રૂા. _____

(ચ) વર્કીંગ કેપીટલ સી.સી.ના કિસ્સામાં

રૂા. _____

(ઘ) શાખા મેનેજરે અંદાજેલી કિંમત

_____ % રૂા. _____

(બી) વાહન લોન (ટુ / થ્રી / ફોર વ્હીલર / ખાનગી / ભાડાના) / ગૃહ વપરાશ લોન :

(૧) ક્વોટેશન મુજબની રકમ

રૂા. _____

બાદ :

(૨) લાગુ પડતી માર્જીનની રકમ

(ક) ટુ વ્હીલર માટે

_____ % રૂા. _____

(ખ) ફોર વ્હીલર ખાનગી માટે

_____ % રૂા. _____

(ગ) ફોર વ્હીલર ભાડા માટે

_____ % રૂા. _____

(ઘ) થ્રી વ્હીલર રીક્ષા માટે

_____ % રૂા. _____

(ચ) ગૃહ વપરાશ માટે

_____ % રૂા. _____

(૩) માર્જીન કાપ્યા બાદની રકમ

રૂા. _____

(૪) ભલામણ કરેલ રકમ

રૂા. _____

બ્રાન્ચ મેનેજરની સહી તથા સિક્કો : _____

નામ: _____

ઈ.ડી.પી. નંબર : _____

શાખા : _____

બ્રાન્ચે ભરવાની માહિતી
ધી ગુજરાત સ્ટેટ કો-ઓપ. બેંક લિ.

લોન અંગેનો ભલામણ રીપોર્ટ

શ્રી જનરલ મેનેજર સાહેબ,

હેડ ઓફિસ, અમદાવાદ

માંગણીની રકમ રૂ. _____

શાખા મેનેજરની ભલામણ રૂ. _____

લોન અરજી ઈન્વર્ડ તારીખ _____ શાખા _____ શાખા કોડ _____

સવિનય જત જણાવવાનું કે અરજદારશ્રી _____ ની _____ હેતુ માટે રૂ. _____ ની લોન માંગણીના આવેલ કાગળો આ સાથે સામેલ છે તેની વિગતો પુરી તપાસતા યોગ્ય જણાયેલ છે.

લોન અરજદાર વ્યક્તિનો ધંધો / વ્યવસાય _____ છે. અથવા _____ સંસ્થામાં નોકરી કરે છે. તેઓની આર્થિક પરિસ્થિતિ અંગે તારીખ _____ ના રોજ તેમના ઘરે / નોકરી / ધંધાના સથળની ચકાસણી કરતા તેઓની આર્થિક પરિસ્થિતિ સારી હોવાનું જણાયેલ છે તેમજ સદરહું લોન સામે મોર્ગેજમાં લેવાની ટાઈટલ ક્લીયર મિલકતનું બેંક માન્ય વેલ્યુઅર મુજબ વેલ્યુએશન / દસ્તાવેજ / બાનાખત / એગ્રીમેન્ટ / એસ્ટીમેટ / ક્વોટેશન / ટર્ન ઓવર મુજબ રૂ. _____ છે જેના _____ % મુજબ રૂ. _____ ધિરાણ મળવાપાત્ર થાય છે.

અરજદારની આવકના પુરાવામાં લેટેસ્ટ ૩ માસની પગાર સ્લીપ / ફોર્મ નં. ૧૬ / સેલેરી સર્ટીફિકેટ / ઈન્કમેટેક્સ રીટર્ન / ધંધાના સરવૈયા / ૭-૧૨ તથા ૮-અ ના દાખલા / દૂધ ભરાવ્યાનો કોમ્પ્યુટરાઈઝ ઉતારો તથા છેલ્લા ૬ માસનું બેંક સ્ટેટમેન્ટ તેમજ ગવર્નમેન્ટ માન્ય અધિકારીના સહી-સિક્કા સાથેનો આવકનો પુરાવો વિગેરેના આધારે અરજદાર તથા સહ અરજદારની વાર્ષિક આવક રૂ. _____ છે જે રજુ કરેલ તમામ આવકના આધારે તથા મોર્ગેજમાં લેવાની મિલકત અંગેના કાગળોની ચકાસણી કરેલ છે જે વાસ્તવિક છે.

બેંકની ધિરાણ નીતિ, શરતો / નિયમો મુજબ તથા સામેલ કરેલા સાધનિક કાગળો જોતાં રૂ. _____ ની _____ લોન / સી.સી. / ઓવરડ્રાફ્ટ _____ વ્યાજના દરે _____ હપ્તા / સુધીની મુદત માટે મંજૂર / રીન્યુ કરવા ભલામણ કરવામાં આવે છે.

ટાઈટલ સર્ટી આપનારનું નામ : _____ વેલ્યુઅરનું નામ : _____

અન્ય જાણવા જેવી હકીકત : ગ્રાહક બેંકના ખાતેદાર હોય તો કેટલા વર્ષથી છે? વ્યવહાર કેવો છે? લોન ભરપાઈ કરી શકે તેમ જણાય છે કે નહીં તે જણાવો.

(બીજી બેંક / ફાઈનાન્સીયલ કંપનીની જો લોન હોય તો તેનો ખાતાનો ઉતારો તથા જો અરજદાર બીજાના જામીન હોય તો વિગતવાર જણાવવું)

જામીનગરી માટે આપવાની મિલકતનું વર્ણન :

માલીકનું નામ :

સોસાયટી / ફ્લેટનું નામ :

આશરે કિંમત રૂ.

જામીનોના નામ :

સરનામા સાથે : * (૧)

(૨)

તથા સરનામું (મિલકત નંબર સાથે) :

મિલકતોની વિગત

(૧)

(૨)

જામીનોએ લોન લીધેલ હોય અગર અન્ય કોઈના જામીન થયેલ હોય તો તેની વિગત

નામ	લોનની રકમ રૂ.	ઉપાડની રકમ રૂ.	વ્યવહાર નિયમીત / અનિયમીત

શાખા મેનેજરની સહી _____ નામ _____ ઈ.ડી.પી. નં. _____ શાખા _____

(૧૮)

હેડ ઓફિસના ઉપયોગ માટે

બાનાખત/એગ્રીમેન્ટ/રજી. દસ્તાવેજ/વેલ્યુએશન/એસ્ટીમેન્ટ/ક્વોટેશન/ટર્ન ઓવર મુજબ રૂા. _____ ના
_____ % મુજબ રૂા. _____ થાય. માસિક આવક રૂા. _____ મુજબ માસિક ચુકવવાની ક્ષમતા
રૂા. _____ ઈ.એમ.આઈ. રૂપિયા _____ મુજબ રૂપિયા _____ ધિરાણ મંજૂર/
રીન્યુ થઈ શકે.

લોન ઓફીસર/આસી. મેનેજરનો અભિપ્રાય :

અરજદારની લોનની માંગણી સામે શાખા મેનેજરશ્રીની ભલામણ, આ ધિરાણ અંગેની બેંકની ધિરાણ નીતિ તથા નીતિ નિયમો, સીક્યોરીટી, અરજદાર તથા જામીનોની આર્થિક સ્થિતિ અને રીપેઈંગ કેપેસિટી વિ. ને ધ્યાનમાં લેતા રૂા. _____ ની
_____ હેતુ માટેની લોન/સીસી/ઓવરડ્રાફ્ટ સવલત _____ % વ્યાજના દરે _____ માસિક હપ્તાની મુદત માટે સામાન્ય
શરતો ઉપરાંત નીચેની શરતોએ મંજૂર/રીન્યુ/નામંજૂર કરવા ભલામણ છે.
શરતો :

તારીખ :

લોન ઓફીસર/આસી. મેનેજર

ઈ.ડી.પી. નંબર

મેનેજરનો અભિપ્રાય :

અરજદારની માંગણી, બ્રાન્ચ મેનેજરની ભલામણ, લોન ઓફિસર/આસી. મેનેજરનો અભિપ્રાય તથા આ ધિરાણ અંગેની બેંકની ધિરાણ નીતિ તથા નીતિ-નિયમો, સીક્યોરીટી, અરજદાર તથા જામીનોની આર્થિક સ્થિતિ અને રીપેઈંગ કેપેસિટી વિ. ને ધ્યાનમાં લેતા રૂા. _____ ની
_____ હેતુ માટેની લોન/સી.સી./ઓવરડ્રાફ્ટ સવલત _____ % વ્યાજના દરે _____ માસિક
હપ્તાની મુદત માટે સામાન્ય શરતો ઉપરાંત નીચેની શરતોએ મંજૂર/રીન્યુ/નામંજૂર કરવા ભલામણ છે.
શરતો :

તારીખ :

મેનેજર

ઈ.ડી.પી. નંબર

સીનીયર મેનેજરનો અભિપ્રાય :

અરજદારની માંગણી, બ્રાન્ચ મેનેજરની ભલામણ, મેનેજરનો અભિપ્રાય તથા આ ધિરાણ અંગેની બેંકની ધિરાણ નીતિ તથા નીતિ નિયમો, સીક્યોરીટી, અરજદાર તથા જામીનોની આર્થિક સ્થિતિ અને રીપેઈંગ કેપેસિટી વિ. ને ધ્યાનમાં લેતા રૂા. _____ ની
_____ હેતુ _____ માટેની લોન/સી.સી./ઓવરડ્રાફ્ટ સવલત _____ % વ્યાજના દરે _____ માસિક હપ્તાની મુદત માટે સામાન્ય શરતો
ઉપરાંત નીચેની શરતોએ મંજૂર/રીન્યુ/નામંજૂર કરવા ભલામણ છે.
શરતો :

છેવટનો અભિપ્રાય :

અરજદારની માંગણી, બ્રાન્ચ મેનેજરની ભલામણ, સીની. મેનેજરનો અભિપ્રાય તથા આ ધિરાણ અંગેની બેંકની ધિરાણ નીતિ તથા નીતિ નિયમો, સીક્યોરીટી, અરજદાર તથા જામીનોની આર્થિક સ્થિતિ અને રીપેઈંગ કેપેસિટી વિ. ને ધ્યાનમાં લેતા રૂા. _____ ની
_____ હેતુ માટેની લોન/સી.સી./ઓવરડ્રાફ્ટ સવલત _____ % વ્યાજના દરે _____ માસિક હપ્તાની મુદત માટે સામાન્ય શરતો ઉપરાંત નીચેની શરતોએ મંજૂર/રીન્યુ/નામંજૂર કરવામાં આવે છે અને આ અંગેની નોંધ/બહાલી
હવે પછી મળનાર આ બેંકની બોર્ડ/એક્ઝિક્યુટીવ કમીટીની મીટીંગમાં લેવાની રહેશે.
શરતો :

તારીખ :

આસી. જનરલ મેનેજર

આસી. જનરલ મેનેજર

આસી. જનરલ મેનેજર

નમૂના

ધી ગુજરાત સ્ટેટ કો-ઓપ. બેંક લિ.

(શિડ્યુલ્ડ એપેક્ષ બેંક)

“સરદાર વલ્લભભાઈ પટેલ સહકાર ભવન” શાસ્ત્રીનગર BRTS બસ સ્ટેન્ડ પાસે,

અંકુર રોડ, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩.

ફો નં. ૦૭૯-૨૭૪૫૮૦૦૦-૦૧-૦૨, ફેક્સ નં. ૦૭૯-૨૭૪૫૮૮૦૦

પ્રતિ,

શ્રીમાન/શ્રીમતી/કુ./મે.,

આપશ્રી તરફથી _____ લોન માટેની રૂા. _____ ની તા. _____ ની માંગણી મળેલ છે જે હાલ ચકાસણી તથા પ્રોસેસમાં છે, ઝડપથી આ અંગે નિર્ણય કરી આપને જાણ કરવામાં આવશે.

આપે _____ ની મિલકત સર્વે નં. _____ સરનામું _____ વાળી મિલકત બેંકની તરફેણમાં ગીરો કરવાની સંમતિ આપેલ છે જેની ટાઈટલ ક્લીયર તથા વેલ્યુએશન વિગેરેની કાર્યવાહી થઈ રહી છે. આ અંગે સાથ-સહકાર આપશો.

આપના ધંધાના સ્ટોક, હિસાબો આપના કે આપની જામીનોના નોકરી/ધંધાના પેપર્સની ચકાસણી થઈ રહી છે તમામ કાર્યવાહી પૂર્ણ થયે ધિરાણ અંગે નિર્ણય કરી આપશ્રીને જાણ કરવામાં આવશે.

બેંકના અધિકારી સ્થળ તપાસ કે જાત તપાસ કરવા આવે તો યોગ્ય સહકાર આપશો જેથી લોન અરજીનું પ્રોસેસીંગ ઝડપથી કરી શકાય.

સહકાર બદલ આભાર,

આપનો વિશ્વાસુ,

નકલ રવાના :-

(૧) જામીનદાર : ૧

બ્રાંચ મેનેજર

શાખા

(૨) જામીનદાર : ૨

નોંધ : આ દાખલાનો નમૂનો છે તેથી આ દાખલો સોસાયટી / એસોસીએશનના છાપેલા લેટરહેડ ઉપર ટાઈપ કરાવી સોસાયટી / એસોસીએશનના ચેરમેન / સેક્રેટરીના સહી-સિક્કા કરાવવા.

અરજી સાથે લેવાનો દાખલો

જત શ્રી / શ્રીમતી / કુ. / મેસર્સ _____ એ સોસાયટી / એસોસીએશનના કાયદેસરના સભ્ય છે અને સોસાયટી / એસોસીએશનના કુલ રૂપિયા _____ ની કિંમતના શેર નંગ _____ નું શેર સર્ટીફિકેટ નંબર _____ તારીખ : _____ નું ધરાવે છે અને સોસાયટી / એસોસીએશનની કુલ સ્વતંત્ર માલિકીની બીન ખેતી જમીન કે રેવન્યુ સર્વે / સીટી સર્વે નંબર _____ નગર રચના યોજના નંબર _____ ના ફાઈનલ પ્લોટ નંબર _____ સબ પ્લોટ નંબર _____ ટેનામેન્ટ બંગલો - બ્લોક - ફ્લેટ - યુનીટ - ઓફિસ - શોપ - ગોડાઉન નંબર _____ વાળી મિલકત કે જેનું ક્ષેત્રફળ _____ સમયોરસ મીટર / ફૂટ છે અને જે _____ ડિસ્ટ્રિક્ટ _____ તાલુકામાં મોજે / સીટી સર્વે _____ ના સીમ / હદમાં આવેલ છે તે મિલકત મજકુર સભ્યનાં નામે ચાલે છે અને વધુમાં મજકુર સભ્યશ્રી તેમના નામે ચાલતા શેર તથા સદરહુ મિલકત _____ બેંક _____ શાખાને પોતે અથવા શ્રી / મેસર્સ _____ માટે મેળવવાની અથવા મેળવેલ નાણાંકીય સવલતો સામે ગીરો કરીને તારણમાં આપવા માંગે છે. ઉપરોક્ત જણાવ્યા પ્રમાણેની મિલકત ગીરો કરવાની આથી મંજુરી આપવામાં આવે છે અને લોન મંજુર થયેથી સદરહુ મિલકત ઉપર બેંકનો પ્રથમ બોજો રાખવામાં આવશે અને જ્યાં સુધી સદરહુ બેંકની નાણાંકીય સવલતો પૂરેપૂરી ભરપાઈ ન થાય ત્યાં સુધી સદરહુ મિલકત કોઈ બીજાને નામે કોઈપણ રીતે ટ્રાન્સફર કરવામાં આવશે નહીં.

વધુમાં સદરહુ નાણાંકીય સવલતો ભરપાઈ કરવામાં ચુક થયેથી સદરહુ બેંક જો સદરહુ મિલકત વેચે-વેચાવે તો જે કોઈ વ્યક્તિ સદરહુ મિલકત વેચાણ રાખે તો સદરહુ મિલકત શેર સહિતની તેવી વ્યક્તિના નામે ટ્રાન્સફર કરી આપવા સોસાયટી / એસોસીએશન આથી બંધાય છે.

વધુમાં મજકુર સભ્યશ્રી પાસે કોઈ લોન કે અન્ય લેણું બાકી નથી, તેમજ સદરહુ મિલકત ઉપર કે કોઈપણ વ્યક્તિ કે સંસ્થાનો ગીરો / બોજો કે ચાર્જ નથી તેમજ તે મિલકત મજકુર પ્રત્યક્ષ કબજા ભોગવટામાં આવેલ છે જેની આથી ખાત્રી આપવામાં આવે છે.

સોસાયટી / એસોસીએશન રજીસ્ટ્રેશન તારીખ _____ નંબર _____

સોસાયટી / એસોસીએશનના

ચેરમેન-સેક્રેટરીની સહી સ્ટેમ્પ સાથે

તારીખ :

સ્થળ :

કો-ઓ.હા.સોસાયટી / એસોસીએશનના લેટરહેડ ઉપર બોજા નોંધના ઠરાવનો નમુનો

બોજા નોંધ

તારીખ : _____

મંડળી / એસોસીએશનની તારીખ : _____ ના રોજ મળેલ વ્યવસ્થાપક કમીટીની મીટીંગમાં થયેલ ઠરાવ નંબર : _____ ની ખરી નકલ.

આથી ઠરાવ કરવામાં આવે છે કે શ્રી _____ અમારી સોસાયટી / એસોસીએશનના સભાસદ છે અને તેઓ શ્રી ને અમારી સોસાયટી / એસોસીએશનમાં ટેનામેન્ટ / ફ્લેટ / બંગલા / દુકાન / ગોડાઉન નંબર _____ ફાળવવામાં આવેલ છે જેના ઉપર ઘી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંક લિ. એ રૂા. _____ (અંકે રૂપિયા _____ પુરા) ની મકાન / સીક્યોરીટી મોર્ગેજ / કોમર્શીયલ પ્રોપર્ટી લોન / વર્કિંગ કેપીટલ સી.સી. / ઓ.ડી. / વાહન લોન શ્રી _____ ને આપેલ છે જેના ઉપર સોસાયટી / એસોસીએશને પોતાના દફતરે અગ્ર હક્કથી બોજાની નોંધ કરેલ છે અને બેંક તરફથી બીજી લેખિત સુચના ના મળે ત્યાં સુધી સદરહુ બોજો રદ કરવામાં નહીં આવે તથા બેંકની સંમતિ વિના નામમાં કોઈ ફેરફાર કરવામાં નહિ આવે તેની આથી ખાત્રી આપવામાં આવે છે.

ચેરમેન / સેક્રેટરીની સહી

મંડળી / એસોસીએશનનો સિક્કો

તારીખ : _____

મંડળી / એસોસીએશનનું સીલ

નોકરીયાત માટે

સંસ્થાનું નામ :

સરનામું :

હોદ્દો :

સંસ્થામાં દાખલ તારીખ :

વાર્ષિક પગાર (ફોર્મ નં. ૧૬ બીડવું) રૂા.

અરજદારનું નામ :

સરનામું :

પ્રતિ,

શ્રી જનરલ મેનેજર સાહેબ,

ધી ગુજરાત સ્ટેટ કો-ઓપ. બેંક લિ.,

અમદાવાદ.

હું નીચે સહી કરનાર શ્રી _____ રહેવાસી

_____ વિનંતી કરું છું કે મેં

રૂા. _____ (અંકે રૂપિયા _____) લોન મેળવવા માંગણી કરેલ છે અને

તેના અનુસંધાને બેંક જે શરતો નક્કી કરે તે તમામ શરતો સ્વીકારવાની હું ખાત્રી આપું છું તથા વિશેષમાં કબુલાત આપું છું કે ગુજરાત સહકારી મંડળીઓના અધિનિયમ-૧૯૬૧ ની કલમ-૫૦ ની જોગવાઈ અનુસાર મારી નોકરીવાળી સંસ્થા પગારમાંથી લોનના હપ્તાની રકમો સીધી બેંકને ચુકવે તે મુજબની વ્યવસ્થા ગોઠવાય તેમાં મારી સંમતિ છે તથા આવી ગોઠવણ સંબંધે મારી નોકરીવાળી સંસ્થા પાસેથી મેળવવાનું જરૂરી વિગતવાળું સ્ટેટમેન્ટ તથા કબુલાત પત્ર તેમના સહી સિક્કા કરાવી મોકલેલ છે જે ખરૂ અને બરાબર છે તે સ્વીકારવા વિનંતી છે.

સ્થળ :

તારીખ :

લોન અરજદારની સહી

લોન લેનાર જે સંસ્થામાં નોકરી કરે છે તે સંસ્થાના અધિકૃત અધિકારીનો દાખલો

આથી દાખલો આપવામાં આવે છે કે શ્રી _____
અમારે ત્યાં નોકરીમાં છે જે અંગેની વિગતો નીચે મુજબ છે.

જે વિભાગમાં કામગીરી કરતા હોય તે વિભાગ	હોદ્દો	કેટલા વર્ષથી નોકરીમાં છે ?	કાયમી કે હંગામી	મોંઘવારી સહીત હાલનો કુલ માસિક પગાર રૂા.	દર મહિને ચુકવાતો નેટ પગાર રૂા.	રીમાર્ક/કોઈપણ પ્રકારના એડવાન્સ/લોન પેટે થતી કપાત રકમ, જો હોય તો રૂા

ઉપર મુજબની વિગતો અમારા રેકર્ડ મુજબ ખરી છે.

ઓફિસરનું નામ અને સરનામું
અધિકારીનો હોદ્દો સહી-સિક્કા સાથે

સંસ્થાનો કબુલાત પત્ર

જા. નં.
પ્રતિ,
શ્રી જનરલ મેનેજર સાહેબ
ધી ગુજરાત સ્ટેટ કો-ઓપ. બેંક લિ.
અમદાવાદ.

સાહેબશ્રી,
આથી દાખલો આપીએ છીએ કે શ્રી _____ અમારે ત્યાં નોકરીમાં છે અને તેનો કુલ
માસિક પગાર રૂા. _____ (અંકે રૂપિયા _____) છે.
વિશેષમાં કબુલાત આપીએ છીએ કે ઉપરોક્ત કર્મચારીના પગારમાંથી દર મહિને તેણે આપની બેંકમાંથી ઉપાડેલ લોન પેટે હપ્તાની રકમ
રૂા. _____ (અંકે રૂપિયા _____) કાપી લઈ તે રકમ ૩ દિવસમાં
બેંકને મોકલી આપીશું. આ રીતે પગારમાંથી કપાયેલ લોનના હપ્તા તારીખ _____ થી શરૂ કરી ત્યારબાદ દર મહિનાની
૧૦ તારીખ પહેલા તેના પગારમાંથી કાપી મોકલતા રહીશું.
અમારા ઉપરોક્ત કર્મચારી અમારી અત્યારની ઓફિસ સ્થળેથી બદલીથી અન્ય સ્થળે કે જગ્યાએ જશે તો તેવા પ્રસંગે ત્યાંના ઓફિસ
અધિકારીને આ કર્મચારીના પગારમાંથી આ લોનની બાકી રકમ, હપ્તાની રકમ કાપવાની જાણ કરીશું તથા તેની બેંકને પણ જાણ કરીશું
અને તેવા પ્રસંગે જે તે ઓફિસર/અધિકારી દ્વારા આ કર્મચારીના પગારમાં લોનના હપ્તાની ઉપરોક્ત રકમ તેના પગારમાંથી કપાત કરી
બેંકને મોકલાતી રહેશે. અમારા આ કર્મચારીનો કોઈપણ કારણસર નોકરીમાંથી છુટા થવાનો પ્રસંગ ઉભો થશે તો તે અંગેની જાણ અમે
તુરંત બેંકને કરીશું. ગુજરાત સહકારી મંડળીઓના અધિનિયમ-૧૯૬૧ ની કલમ-૫૦ ના પ્રબંધો લાગુ પડતા હોવાનું સ્વીકારીએ છીએ.

સીલ/સિક્કો

સંસ્થાનું નામ
અધિકારીની સહી
તથા ટુંકું નામ

મંડળીનું નામ : _____

મંડળી દ્વારા સભાસદે લીધેલ ધિરાણો તથા તેની વસુલાતની છેલ્લા ૩ વર્ષની માહિતી

વર્ષ	ધિરાણનો પ્રકાર	ધિરાણની રકમ	આવેલ વસુલાતની રકમ
૨૦ -૨૦			
૨૦ -૨૦			
૨૦ -૨૦			

સહકારી મંડળી પાસેથી લીધેલ લોનનો દાખલો
(સહકારી મંડળીના લેટરપેડ ઉપર)

ઉપરોક્ત ખાતેદાર ધી _____ મંડળીના સભાસદ છે. સદર
ખાતેદારે અમારી ખેતી વિષયક મંડળીમાંથી તારીખ _____ ના રોજ ટુંકી મુદત / મધ્યમ મુદતનું
રૂા. _____ રકમનું ધિરાણ લીધેલ છે જે આજ તારીખના રોજ રૂા. _____ ઉપાડ છે જે
નિયમિત / મુદતવીતીની ધિરાણ છે જે મંડળીના રેકૉર્ડ ઉપરથી તપાસી સદર દાખલો આપેલ છે.

મંડળીનું સીલ

મંડળીના હોદ્દેદારની સહી

મોબાઇલ બેંકિંગ



ઇન્ટરનેટ બેંકિંગ



એટીએમ સર્વિસ



પ્લેટીનમ કાર્ડ



RuPAY એટીએમકમડેબીટ કાર્ડ એન્ડ ઇ-કોમર્સ



લોકર સુવિધા



IMPS
IMMEDIATE PAYMENT SERVICE

ઇન્શ્યોરન્સ સર્વિસ

હેલ્થ ઇન્શ્યોરન્સ



એક્સીડન્ટ ઇન્શ્યોરન્સ



- ◆ જ્યોતિર્ગમય બીમા યોજના પ્લસ (મેડીક્લેમ)
- ◆ જ્યોતિર્ગમય અકસ્માત બીમા યોજના
- ◆ પ્રધાનમંત્રી જીવનજ્યોતિ બીમા યોજના (PMJJBY)
- ◆ પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના (PMSBY)
- ◆ અટલ પેન્શન યોજના (APY)

“સરદાર વલ્લભભાઈ પટેલ સહકાર ભવન”



PRINTED AT : Gujarat OFFSET A'BAD. Ph. 2583191